

અંશત: ઉપાડના કિસ્સામાં અનુસરવાની કાર્યપદ્ધતિ

નવી વર્ધિત પેન્શન યોજના અંતર્ગત એન.એસ.ડી.એલમાંથી અંશત: રકમ પરત મેળવવા માટે નીચે જણાવ્યા મુજબ દરખાસ્ત તૈયાર કરી બે નકલમાં મોકલી આપવાની રહેશે.

1. કર્મચારી પાસેથી ઓનલાઇન ભરેલ ફોર્મ મેળવવું.

- ઓનલાઇન ફોર્મ માટે કર્મચારીએ www.cra-nsdl.com વેબસાઇટ પર લોગઇન કરવું
 - (લોગઇન આઇડી, પાસવર્ડ પ્રાનકિટમાં આપેલ હોય છે. પ્રાનકિટ ન હોય તેવા કિસ્સામાં CSRF-1.1 ફોર્મ ભરી મોકલી આપવું, પ્રાનકિટ ઇસ્યુ થયા બાદ જ ઉપરોક્ત કાર્યવાહી કરી શકાશે.)
 - Login થયા બાદ Menu “Transaction” પર ક્લિક કરવું. ત્યારબાદ Sub Menu “Initiate Conditional Withdrawal” પર ક્લિક કરવું
- જેમાં Available Self Contribution તેમજ Available Withdrawal Amount ની રકમ દેખાશે
- વધુમાં Percentage to be Withdrawal Allocation માં મહત્તમ 25% ઉપાડ કરી શકાય છે
- ત્યાર બાદ Withdrawal Reason માં આપેલ ચાર વિકલ્પ પૈકી કોઇ એક સીલેક્ટ કરવા.
 - Higher Education
 - Marriage of his or her Children
 - Purchase or Contraction
 - Treatment of specified illness
- બેંકની વિગતો જોઇ શકાશે. જે ચેક કરી યોગ્ય જણાય તો Confirm પર ક્લિક કરવું. જો ખાતેદાર બેંકની વિગતો સુધારવા-અપડેટ કરવા માંગતા હોય તો Edit પર ક્લિક કરી પગાર જમા થતો હોય તે બેંક એકાઉન્ટની વિગતો ભરી સુધારી શકાશે.
- મોબાઇલ તેમજ ઇ-મેલની વિગતો જોઇ શકાશે. જે ચેક કરી યોગ્ય જણાય તો Confirm પર ક્લિક કરવું. જો ખાતેદારની મોબાઇલ તેમજ ઇ-મેલની વિગતો સુધારવા માંગતા હોય તો Edit પર ક્લિક કરી વિગતો અપડેટ કરી શકાશે.
- Check List Menu માં જઇ Withdrawal Form સાથે રજૂ કરવાના ડોક્યુમેન્ટ સીલેક્ટ કરી ઉપાડ અંગેની અરજી ઓનલાઇન Submit કરવી.
- સફળતાપૂર્વક Online Withdrawal Form Submit થયા બાદ Acknowledgement-ID નંબર જનરેટ થશે. જેની ખાતેદારે પ્રિન્ટ લઇ લેવી.

2. ત્યાર બાદ નાણા વિભાગનાં તા. 03/08/2017 નાં ઠરાવ ક્રમાંક-નપન-102019-ડી-284-પી માં જણાવ્યા અનુસારનું **Form: 601 PW** (NSDL ની વેબસાઇટ www.npscra.nsdl.co.in પરથી મેળવી લેવું) માં જરૂરી વિગતો ભરી સક્ષમ સત્તાધિકારીના સહી સિક્કા કરી તેમજ જરૂરી બિડાણ સાથે અત્રેની કચેરીને મોકલી આપવું.

3. તેમજ સદર ઠરાવમાં સામેલ અનુસૂચિ - ૧ માં પણ જરૂરી વિગતો ભરી સક્ષમ સત્તાધિકારીના સહી સિક્કા કરી તેમજ જરૂરી બિડાણ સાથે અત્રેની કચેરીને મોકલી આપવું.